

## ઇઝ ઓફ ડુઇંગ બિઝનેસમાં ભારતનું રેન્કિંગમાં ક્રમ 100મો

- ઇઝ ઓફ ડુઇંગ બિઝનેસમાં ભારતનું રેન્કિંગ 30 અંક જેટલું સુધર્યું છે. આ મોરચે ભારતને દુનિયામાં 100મો ક્રમ મળ્યો છે. ગયા વર્ષે ભારતનું રેન્કિંગ 130 પર હતું. વર્લ્ડ બેન્કે આ રીપોર્ટ મંગળવારે જાહેર કર્યો છે. નાણાપ્રધાન અરુણ જેટલીએ આ માહિતી આપી છે.

પ્રથમવાર ટોપ 100માં સામેલ: નાણાપ્રધાન અરુણ જેટલીએ જણાવ્યું કે રીપોર્ટ અનુસાર, ભારતમાં બિઝનેસ કરવાનું સરળ બન્યું છે. તેમણે કહ્યું કે પ્રથમવાર ભારત ટોપ 100 દેશોમાં સામેલ થયો છે. આ રેન્કિંગમાં કોઈ દેશે નોંધાવેલો આ સૌથી મોટો ઊછાળો છે. હવે ટોપ 50માં સામેલ થવાનું મુશ્કેલ નથી.

**અન્ય બાબતોના રેન્કિંગમાં ક્યાં છે ભારત:**

- નાના શેરધારકોની સુરક્ષાની બાબતમાં ભારત પાંચમા ક્રમે
- વીજળી કનેક્શનની બાબતમાં ભારત 126મા ક્રમ પર
- બિઝનેસ શરૂ કરવાની બાબતમાં ભારતને 156મો ક્રમ મળ્યો.
- કોન્ટ્રાક્ટ લાગુ કરવામાં ભારત 164મા ક્રમ પર
- પ્રોપર્ટી રજિસ્ટ્રેશન કરાવવામાં ભારતનો ક્રમ 154
- વિદેશ વ્યાપારમાં ભારત 146મા ક્રમ પર
- દેવાળિયાના કેસોને હલ કરવામાં ભારત 103મા ક્રમ પર
- બિઝનેસ રેન્કિંગમાં ભારત 29મા ક્રમ પર
- ટેક્સ પેમેન્ટની બાબતમાં ભારત 119મા ક્રમ પર
- કન્સ્ટ્રક્શન પરમિશનમાં ભારતને 181મો ક્રમ

**બ્રિક્સ દેશોની સ્થિતિ:**

- રશિયા- 35મા ક્રમે
- ચીન- 78મા ક્રમે
- દક્ષિણ આફ્રિકા- 82મા ક્રમે
- ભારત- 100મા ક્રમે
- બ્રાઝીલ - 121મા ક્રમે

### લિસ્ટમાં ટોપ 5 દેશ:

- ન્યુઝીલેન્ડ- 1
- સિંગાપોર- 2
- ડેન્માર્ક -3
- કોરીયા - 4
- હોંગકોંગ -5

### કોમનવેલ્થ શૂટિંગમાં સિંધુને ગોલ્ડ મેડલ અને દીપકકુમારને બ્રોન્ઝમેડલ

- ઓસ્ટ્રેલિયાના બ્રિસ્બેન શહેરમાં ચાલી રહેલી કોમનવેલ્થ શૂટિંગ ચેમ્પિયનશિપમાં ભારતની હીના સિંધુએ શાનદાર શરૂઆત કરતાં ૧૦ મીટર એર પિસ્ટલ સ્પર્ધામાં ગોલ્ડ મેડલ મેળવ્યો હતો. ફાઇનલમાં હીના સિંધુએ ૨૪૦.૮નો સ્કોર કરી ગોલ્ડ મેડલ જીત્યો હતો. આ સ્પર્ધામાં ઓસ્ટ્રેલિયાની એલેના ગાલિયાબોવિચ ૨૩૮.૨ પોઇન્ટ સાથે સિલ્વર મેડલ જીતી હતી. ઓસ્ટ્રેલિયન શૂટર ક્રિસ્ટી ગિલમેને ૨૧૩.૭નો સ્કોર કરી બ્રોન્ઝ મેડલ જીત્યો હતો.

- આ મહિનામાં ભારતની રાજધાની દિલ્હીમાં યોજાયેલ ISSF વર્લ્ડ કપની ફાઇનલ્સમાં જિતુ રાય સાથે મળીને ૧૦ મીટર એર પિસ્ટલના મિક્સ્ડ વર્ગમાં ગોલ્ડ

મેડલ મેળવ્યા બાદ સિંધુએ સતત બીજો ગોલ્ડ મેળવ્યો છે. અન્ય ભારતીય શૂટરોમાં ટીપકકુમારે બ્રોન્ઝ મેડલ પોતાના નામે કર્યો હતો. જ્યારે આ જ ચેમ્પિયનશિપમાં લંડન ઓલિમ્પિકમાં બ્રોન્ઝ મેડલ મેળવનારા ગગન નારંગે ચોથું અને રવિકુમારે પાંચમું સ્થાન મેળવ્યું હતું. ક્વોલિફિકેશન રાઉન્ડમાં નારંગે ૬૨૬.૨નો સ્કોર કરી કોમનવેલ્થ રેકોર્ડ બનાવ્યો હતો.

### Safar On Gkgrips

- ❖ **Join Our Telegram Channel: [Click Here](#)**
- ❖ **Download Our Application: [Click Here](#)**
- ❖ **Free Online Course: [Click Here](#)**
- ❖ **Online Books: [Click Here](#)**
- ❖ **Join Our Whats App Group: [Click Here](#)**